



RAN-2408000604030010

S. Y. B. Com (Sem. - IV) (NCF-NEP) Examination October - 2025
Macro Economics (Paper - IV - Minor)

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.
- (2) પ્રશ્ન નં. 1 ફરજિયાત છે.
Question No. 1 is compulsory.
- (3) જમણી બાજુ દર્શાવેલા અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે.
Figure of the right indicate full marks of questions.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર. 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (કોઈપણ પાંચ)

(10)

1. રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ જણાવો.
2. કેઈન્સે આપેલ મૂડીની સીમાંત કાર્યક્ષમતાનું સૂત્ર જણાવો.
3. સરેરાશ અને સીમાંત બચતવૃત્તિના ખ્યાલો સમજાવો.
4. મોસમી પરિવર્તનો એટલે શું?
5. વિનિમય દર એટલે શું?
6. જાહેર અર્થવિધાન અને ખાનગી અર્થવિધાનનો તફાવત જણાવો.
7. હિયમાન કરવેરા એટલે શું?

પ્ર. 2. કુલ રાષ્ટ્રીય પેદાશ, ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ, કુલ આંતરિક પેદાશ અને ચોખ્ખી આંતરિક પેદાશના ખ્યાલો સમજાવો.

(14)

અથવા

પ્ર. 2. કેઈન્સે આપેલ નીચેના ખ્યાલો વિગતવાર સમજાવો.

(14)

- અ. કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત.
- બ. સરેરાશ ઉપભોગ વિધેય અને સીમાંત ઉપભોગ વિધેય.

પ્ર. 3. સમજરીદ શક્તિનો સિધ્ધાંત તેની મર્યાદાઓ સહિત સમજાવો.

(14)

અથવા

પ્ર. 3. અ. જાહેર ખર્ચની વહેંચણી પરની અસરો સમજાવો.

(07)

બ. વ્યાપાર ચક્ર એટલે શું? વેપાર ચક્રની લાક્ષણિકતાઓ સવિસ્તાર સમજાવો.

(07)

પ્ર. 4. ટૂંકનોંધ લખો. (કોઈપણ બે)

(12)

1. વેતન કાપનો સિધ્ધાંત
2. ગુણકના બહિસ્ત્રાવો
3. વસ્તુઓ અને સેવાઓ પરના વેરાની અસરો
4. આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ

ENGLISH VERSION

- Q. 1. Answer the following question in brief: (Any five) (10)**
1. State the methods of measurement of national income.
 2. State the equation of marginal efficiency of capital given by Keynes.
 3. Explain concepts of average and marginal propensity to save.
 4. What are seasonal fluctuations?
 5. What is exchange rate?
 6. State the difference between public finance and private finance.
 7. What is regressive taxation?
- Q. 2. Explain the concept of gross national product, net national product, gross domestic product and net domestic product. (14)**
- OR**
- Q. 2. Explain in detail the following concepts given by Keynes: (14)**
- A. Aggregate demand price and aggregate supply price.
 - B. Average propensity to consume and marginal propensity to consume.
- Q. 3. Explain the theory of purchasing power parity with its limitations. (14)**
- OR**
- Q. 3. A. Explain the effect of public expenditure on distribution. (07)**
- B. What is trade cycle? Explain in detail the characteristics of trade cycle. (07)**
- Q. 4. Write Short Notes: (Any two) (12)**
1. Theory of wage cut.
 2. Leakages of the multiplier.
 3. The effects of goods and services tax.
 4. Importance of international trade.
-